

ફિલેમોને પત્ર

1

પ્રકરણ 1

અમારા પ્રિય મિત્ર અને અમારા સહ-કાર્યકર ફિલેમોનેને ઉદ્દેશીને આ પત્ર છે. આપણી બહેન આફ્રિયા, અમારા એક સહ-કાર્યકર આર્થિપસ, અને તારા ઘરમાંની એકતરીત મંડળી એ સર્વનાં નામ જોગ લખિતંગ.

² ખ્રિસ્ત ઇસુનો બંદીવાન પાઉલ તથા આપણો ભાઈ તિમોથી.

³ દેવ આપણા પિતા અને પ્રભુ ઇસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ પ્રાપ્ત થાઓ.

⁴ મારી પ્રાર્થનાઓમાં હું તને યાદ કરું છું. અને તારા માટે હું હંમેશા મારા દેવની આભારસ્તુતિ કરું છું.

⁵ દેવ અને સર્વ સંતો માટે તને જે પ્રેમ છે અને પ્રભુ ઇસુમાં તને વિશ્વાસ છે, તે વિષે મેં સાંભળ્યું છે. અને તારા એ વિશ્વાસ અને પ્રેમ બદલ હું દેવની આભારસ્તુતિ કરું છું.

⁶ મારી પ્રાર્થના છે કે જે વિશ્વાસમાં તું સહભાગી થયો છે તેને લીધે ખ્રિસ્તની દરેક સારી બાબત આપણામાં છે તે આપણને ખ્રિસ્ત તરફ દોરી જાય છે તે સારી બાબત તું સમજી શકીશ.

⁷ મારા ભાઈ, તે દેવના લોકો પ્રત્યે પુષ્કળ પ્રેમ દર્શાવ્યો છે. તે તેઓને સુખી કર્યા છે. આથી મારા મનને ખૂબ જ આનંદ તથા દિલાસો મળ્યો છે.

⁸ એક બાબત છે કે જે તારે કરવાની છે અને ખ્રિસ્તમાં તારા પ્રેમને કારણે તને તે કરવાની આજ્ઞા આપવાની મને છૂટ છે.

⁹ પણ હું તને આજ્ઞા કરતો નથી; હું તો તને તે કામ કરવા જણાવું છું. હું પાઉલ છું, હવે હું વૃદ્ધ થયો છું, અને ખ્રિસ્ત ઇસુના કારણે હું કેદી થયો છું.

¹⁰ મારા પુત્ર સમાન ઓનેસિમસ વિષે હું તને કહું છું. હું જ્યારે કેદમાં હતો ત્યારે તે મારો ધર્મપુત્ર થયો છે.

¹¹ ભૂતકાળમાં તો તે તારાં માટે નકામો જ હતો. પરંતુ તે હવે આપણા બંને માટે ઉપયોગી બન્યો છે.

¹² હું તારી પાસે તેને પાછો મોકલું છું. મારાં પોતાનું હૈયું હું તેની સાથે મોકલું છું.

¹³ સુવાર્તાને કારણે હું જ્યારે જેલમાં છું એવા સમયે તે મને મદદરૂપ થાય, એ માટે હું તેને મારી પાસે જ અહીં રાખવા ઈચ્છતો હતો. મને મદદ કરતાં કરતાં એ તારી જ સેવા કરે.

¹⁴ પરંતુ એ માટે તને અગાઉથી પૂછવા વિના કંઈ પણ કરવું મને ન ગમે. તારી પર દબાણ કરીને કામ સોંપુ છું એમ નહિ પરંતુ મારા માટે તું જે કંઈ સાચું કરે તે તારી સ્વેચ્છાથી થાય એમ હું ઈચ્છું છું.

¹⁵ ઓનેસિમસ થોડા સમય માટે તારાથી છૂટો પડી ગયો હતો, એવું કદાચ એટલા માટે બન્યું કે તે જ્યારે પાછો આવે ત્યારે હંમેશને માટે તારો થઈને રહે.

¹⁶ દાસ તરીકે નહિ, પરંતુ દાસ કરતાં કંઈક વધારે સારો, વહાલા ભાઈ તરીકે હું તેને ખૂબ પ્રેમ કરું છું. પરંતુ તું એને વધારે પ્રેમ કરીશ. કેવળ એક મનુષ્યના રૂપે અને પ્રભુમાં સ્થિર એક ખ્રિસ્તી ભાઈ તરીકે પ્રેમ કરજે.

¹⁷ જો તારા મિત્ર તરીકે તું મને સ્વીકારતો હોય તો, તું ઓનેસિમસને ફરી પાછો અપનાવી લેજે. મારાં સ્વાગત કરે તેમ તું એને આવકારજે.

¹⁸ ઓનેસિમસે જો તારા માટે કંઈક ખોટું કર્યું હોય અથવા જો તેણે તારાં દેવું કર્યું હોય, તો તે મારા ખાતે ઉધારજે.

¹⁹ હું પાઉલ છું, અને મારા પોતાના હાથે હું આ લખી રહ્યો છું. ઓનેસિમસનું જે કાંઈ દેવું હોય તે હું ભરપાઈ કરી આપીશ. અને જો કે તારા પોતાના જીવન માટે તું મારો કેટલો ઋણી છું, તે વિશે હું કશું જ નથી કહેતો.

- ²⁰ તેથી, મારા ભાઈ, ખ્રીષ્ટમાં તું મારી માટે કઈક કરી જતાવ. ખ્રિસ્તમાં મારા દરદયને તું શાંત કર.
- ²¹ હું તને આ પત્ર લખું છું કારણ મને ખાતરી છે કે હું જે ઇચ્છું છું તે કામ તું કરીશ જ. હું જાણું છું કે હું જે કહું છું તે કરતાં પણ કઈક વધારે કરીશ.
- ²² વળી, મારે રહેવા માટે પણ એક ઓરડો તું તૈયાર કરાવી રાખજે. મને આશા છે કે દેવ તારી પ્રાર્થનાઓનો પ્રત્યુત્તર આપશે અને હું તારી પાસે આવી શકીશ.
- ²³ ખ્રિસ્ત ઇસુ માટે કેદી બનેલો એપાફ્રાસ પણ મારી સાથે છે. તે તને ક્ષેમકુશળ કહે છે.
- ²⁴ વળી માર્ક, અરિસ્તાર્કસ, દેમાસ અને લૂક પણ તને ક્ષેમકુશળ કહે છે. તેઓ મારી સાથેના કાર્યકરો છે.
- ²⁵ આપણા ખ્રીષ્ટ ઇસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્મા પર થાઓ.

For other languages please go to www.wordproject.org